



ડૉ. બાબાસાહેબ અમંબેડકર ઓપન યુનિવર્સિટી

(ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત)

“જ્યોર્તિમય” પરિસર,

શ્રી બાલાજી મંદિરની સમે, સરખેજ-ગાંધીનગર હાઈવે,

છારોડા, અમદાવાદ-૩૮૨ ૪૮૧

E-mail: feedback@baou.edu.in Website : www.baou.edu.in

સત્રીયકાર્ય જૂન- ૨૦૧૬

સ્નાતક પદ્ધતી અભ્યાસકુમાર (BDP)

પાઠ્યકુમ શીર્ષક

AOM, ASP

કાર્યાલય વ્યવસ્થાતંત્ર અને સંચાલન :- AOM-01

સેકેટરીયલ પ્રેક્ટીસ :-ASP-01

અગત્યની સૂચનાઓ

- ✓ વિદ્યાર્થીઓએ પોતાના પાઠ્યકુમોના સ્વાધ્યાયકાર્યો અભ્યાસકેન્દ્ર/યુનિવર્સિટીની વેબ-સાઈટ પરથી મેળવવાના રહેશે.
- ✓ સત્રાંત પરીક્ષા આપવા માટે સ્વાધ્યાય કાર્ય રજુ કરવા ફરજીયાત છે. સ્વાધ્યાય કાર્ય જમા કરાવેલ નહીં હોય, તો પરીક્ષા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
- ✓ તૈયાર કરેલ સ્વાધ્યાયકાર્યો અભ્યાસકેન્દ્ર પર જમા કરાવવાની છેલ્લી તારીખ ૩૦/૧૨/૨૦૧૬ છે. આ તારીખ પછી વિદ્યાર્થીઓ દ્વારા મોકલાવેલ સ્વાધ્યાયકાર્યો સ્વીકારવામાં આવશે નહીં.
- ✓ જમા કરાવેલ સ્વાધ્યાયકાર્યોની પહોંચ અભ્યાસકેન્દ્ર પરથી લેવી ફરજીયાત છે.
- ✓ વિદ્યાર્થીઓએ નિયત સમય મર્યાદામાં સ્વાધ્યાયકાર્યો અભ્યાસકેન્દ્ર પર જમા કરાવવા તેમજ મૂલ્યાંકન થયા બાદ મૂલ્યાંકન પત્રક સાથેના સ્વાધ્યાયકાર્યો અભ્યાસ કેન્દ્ર પરથી અવશ્ય પરત લેવા.
- ✓ વિદ્યાર્થી પોતાના સ્વાધ્યાયકાર્યોના ગુણ યુનિવર્સિટીની વેબ-સાઈટ પર જોઈ શકશે.
- ✓ આ પાઠ્યકુમ સ્નાતક પદ્ધતીનાં તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે વ્યવસાયલક્ષી પઠ્યકુમો પૈકીનો એક છે.
- ✓ ત્રીજા વર્ષમાં વિદ્યાર્થી માટે વ્યવસાયલક્ષી પાઠ્યકુમો પૈકી ઓછામાં ઓછા ૮ કેટિના અને વધુમાં વધુ ૧૬ કેટિના પાઠ્યકુમો પસંદ કરવાના રહેશે.

સત્તીયકાર્ય માટે આવશ્યક સૂચનાઓ

પ્રિય વિદ્યાર્થી મિત્રો

આપને દરેક પાઠ્યકમદીઠ એક સત્તીયકાર્ય તૈયાર કરવાનું ફરજિયાત છે. દરેક સત્તીયકાર્ય તમામ અભ્યાસ-સામગ્રી પર આધારીત હોય છે.

સત્તીયકાર્ય તૈયાર કરી આપના અભ્યાસકેન્દ્રના સંયોજકશી પાસે જમા કરાવવું અને તેની પાવતી અવશ્ય લેવી. દરેક સત્તીયકાર્યની એરોક્ષ નકલ આપની પાસે રાખવી.

દરેક સત્તીયકાર્યના ૧૦૦ ગુણ નિશ્ચિત છે. જેમાં પાસ થવા માટે B.A./B.com.માં ઉદ ગુણ લાવવા જરૂરી છે. પરિણામમાં તેનો ભારાંક ૩૦% હોય છે. અભ્યાસકેન્દ્ર દ્વારા મૂલ્યાંકન કરાવેલ સત્તીયકાર્યો પરીક્ષામાં વાંચવા માટે પરત અવશ્ય લેવું. અભ્યાસકેન્દ્ર આપના સત્તીયકાર્યના ગુણો યુનિવર્સિટી અમદાવાદ ખાતે મોકલી આપશે. જે આપની માર્કશીટમાં ગુણગ્રેડ યાદીમાં સામેલ કરી (૭૦% પરીક્ષા અને ૩૦% સ્વાધ્યાયકાર્ય) ફાઈનલ ગુણગ્રેડ માર્કશીટ તૈયાર થશે.

આ સત્તીયકાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષા માટેની પૂર્વ તૈયારી છે. સત્તીયકાર્યમાં પૂછવામાં આવેલ પ્રશ્નોનું માળખું પરીક્ષાના પ્રશ્નપત્રો જેવું હોય છે. પ્રશ્નોના જવાબમાં અભ્યાસ સામગ્રીનું પુનરાવર્તન કરવાનું નથી હોતું. આપ વાંચનથી જે શીખ્યા છો, તે પોતાની ભાષામાં લખવાનું હોય છે. જેથી આપ સ્વાધ્યાયકાર્યો તૈયાર કરવાની કામગીરી ગંભીરતાથી કરશો.

યુનિવર્સિટીમાં વર્ષ-૨૦૦૮ સુધીના પ્રવેશાર્થીઓ માટે B.A./B.Com. ના પ્રથમ ,દ્વિત્ય તથા તૃત્ય વર્ષના તમામ અભ્યાસક્રમ/પાઠ્યકમમાં ચાર કેરિટના પાઠ્યકમમાં બે અને આઠ કેરિટના પાઠ્યકમમાં ત્રણ સ્વાધ્યાયકાર્યો તૈયાર કરવાનો નિયમ હતો. એકેટેમીક પ્લાનીંગ બોર્ડની (A.P.B. મંજૂરી થી) ઓગષ્ટ-૨૦૦૮ થી પાઠ્યકમ દીઠ એક-એક સ્વાધ્યાયકાર્ય રજૂ કરવાની નવી પદ્ધતિ શરૂ થયેલ છે. તેથી આપને પાઠ્યકમ દીઠ એક-એક સ્વાધ્યાયકાર્ય જે આપને આપના અભ્યાસકેન્દ્ર/યુનિવર્સિટીની વેબ-સાઈટ પરથી મેળવવાના હોય અને તેને નિશ્ચિત થયેલ છેલ્લી તારીખમાં સ્વ-અધ્યયનના આધારે તૈયાર કરી, આપના અભ્યાસકેન્દ્ર પર જમા કરાવવાના રહેશે.

આપના પાઠ્યકમના સ્વાધ્યાયકાર્યોમાં પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબ લખતા પહેલા પ્રથમ પાના ઉપર નીચે મુજબની માહિતી લખવી જરૂરી છે.

નોંધણી નંબર:- _____
પૂર્ણ નામ:- _____
સરનામું:- _____
મોબાઇલ નંબર:- _____

અભ્યાસક્રમ:- _____
પાઠ્યકમ:- _____
સ્વાધ્યાય સંખ્યા:- _____
તારીખ:- _____

અમે ઈચ્છાઓ છીએ કે આપ દરેક સત્તીયકાર્ય અલગ-અલગ ચોપડામાં સુંદર ભાષામાં ઉપર દર્શાવેલ મુજબની માહિતી સાથે નિયત સમય મર્યાદામાં તૈયાર કરી અભ્યાસકેન્દ્ર પર જમા કરાવશો. મૂલ્યાંકન થયા બાદ મૂલ્યાંકન પત્રક સાથે પોતાના સ્વાધ્યાયકાર્યો અભ્યાસકેન્દ્ર પરથી પરત અવશ્ય લેવું.

જૂના વિદ્યાર્થીઓ (૨૦૦૮ સુધીના) માટે જૂની પદ્ધતિના સ્વાધ્યાયકાર્યો યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે, જે ધ્યાને લેવું.

શુભેચ્છા સહ,

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

પાઠ્યક્રમ કોડ :- AOM-01 :- કાર્યાલય વ્યવસ્થાતંત્ર અને સંચાલન

સત્રીયકાર્ય કોડ :- AOM-01/AST-01/TMA/2016

(તમામ પાઠ્યસામગ્રી પર આધારિત)

અત્યાસ કેન્દ્રને સૌંપવાની છેલ્લી તારીખ :- 30/12/2016

(કુલ ગુણઃ-100)

વિભાગ -ક : વિવરણાત્મક શ્રેષ્ઠીના પ્રશ્નોના જવાબ ૧૫૦૦ શબ્દોમાં આપો.

(2x20=40)

- ૧ કાર્યાલય સ્થાન એટલે શુ? સ્થાનની પસંદગી વિષે વિગતે માહિતી આપો કાર્યાલય જગ્યા પ્રાપ્ત કરવા વિષે ચર્ચા કરો.

અથવા

રેકોર્ડિનું મહત્વ જણાવી રેકોર્ડ સંચાલન વિષે વિસ્તૃત માહિતી આપો.

૨. કાર્યાલય માહિતી સંચારનું મહત્વ જણાવી તેના તત્ત્વો અને પ્રક્રિયા વિષે વિગતે માહિતી આપો.

અથવા

કાર્યાલય નિરિક્ષણનો અર્થ જણાવી કાર્યાલય નિરિક્ષકની ભૂમિકા વિષે વિસ્તૃત ચર્ચા કરો.

વિભાગ ખ : મધ્યમ શ્રેષ્ઠીના પ્રશ્નોના જવાબ ૧૫૦૦ શબ્દોમાં આપો. (ગમે તે બે) (૨x૧૫= ૩૦)

- ૧ કાર્યાલય સંચાલક (મેનેજર)ના કાર્યો, લાયકાતો, તથા મોભા વિષે વિગતે માહિતી આપો.
- ૨ કાર્યાલય વ્યવસ્થાના ફાયદા-મર્યાદાઓ વર્ણવી ઓફીસ પુસ્તિકા વિષે માહિતી આપો.
- ૩ ફાઈલિંગના સંદર્ભમાં અનુક્રમણિકાનું મહત્વ, ફાયદા તથા પ્રકારો જણાવો.
- ૪ કાર્યાલય માહિતી સંચારનું મહત્વ જણાવી માહિતી સંચારના તત્ત્વો અને પ્રક્રિયા જણાવો.

વિભાગ ગ : નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (ગમે તે ચાર) (૪x૫= ૨૦)

- ૧ આંતરિક માહિતી સંચારના સ્વરૂપો જણાવો.
- ૨ ટપાલ સેવાનું મહત્વ જણાવો.
- ૩ કાર્યાલય યાંત્રિકરણના ફાયદાઓ જણાવો.
- ૪ કાર્યાલય લેખન સામાન્ય અને ભંડારના સંદર્ભમાં ખરીદીની વિધિ જણાવો.
- ૫ કાર્યસરળીકરણ માટે ધ્યાનમાં લેવાના પરિબળો જણાવો.

વિભાગ ઘ : હેતુલક્ષી પ્રશ્નો/ બહુવિકલ્પ (M.C.Q) આધારીત પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધી સાચા જવાબ સામે (✓) કરો./ખાલી જગ્યા પુરો/હા-ના માં જવાબ આપો./જોડકા જોડો. (ગમે તે દશ) (૧x૧૦= ૧૦)

- ૧ એટલે વ્યક્તિઓ વચ્ચે વિચારો અને ઈરાદાઓનો વિનિમય
- ૨ એક જગ્યાએ અને એક જ વિભાગમાં ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓ એટલે
- ૩ વિવિધ વિભાગોમાં અલગ રીતે ચલાવવામાં આવતી પ્રવૃત્તિ એટલે
- ૪ વિશાળ રૂમ અથવા ખંડ કે જ્યાં સમગ્ર કાર્યાલય કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવે છે તેને કહેવાય.

- ૫ એટલે કાર્યાલયમાં માણસો, માલ-સામગ્રી, યંત્રો, સાધનો મુકવા અને ગોઠવણી.
- ૬ પ્રકાશનું સામાન્ય ભાપ એટલે
- ૭ યોગ્ય રંગ મિશ્રણની પસંદગી કે જેથી માનવીય લાગણીઓને ઉત્તેજન મળે તેને કહે છે.
- ૮ રૂમ અથવા મકાનની અંદર સુશોભન કરવાની રીત એટલે
- ૯ અમુક કાર્ય કરવા માટેની આયોજિત રીતને કહે છે.
- ૧૦ એટલે સમાન લક્ષાંક માટે એકઠી થયેલી વ્યક્તિત્વો દ્વારા કરાતું કાર્ય.
- ૧૧ જુદા-જુદા પક્ષો વચ્ચે જોડાણ તરીકે જે કાર્ય કરે તેને કહે છે.
- ૧૨ જેના પ્રત્યે પ્રયાસો લક્ષિત કરવામાં આવ્યા હોય તેને કહે છે.

AOM-01

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

પાઠ્યક્રમ કોડ :- ASP-01:- સેકેટરીયલ પ્રેક્ટીસ

સત્રીયકાર્ય કોડ :- ASP-01/AST-01/TMA/2016

(તમામ પાઠ્યસામગ્રી પર આધારિત)

અભ્યાસ કેન્દ્રને સૌંપવાની છેલ્ખી તારીખ :- 30/12/2016

(કુલ ગુણઃ-100)

વિભાગ -ક : વિવરણાત્મક શ્રેષ્ઠીના પ્રશ્નોના જવાબ ૧૫૦૦ શબ્દોમાં આપો.

(2x20=40)

૧. સેકેટરી એટલે શુ? તેનું મહત્વ, ભૂમિકા અને ફરજો જણાવો.

અથવા

સભા એટલે શું? તેનું વર્ગિકરણ, આવશ્યક લક્ષણો જણાવી સભાઓના નિયમનના નિયમો વિષે વિસ્તૃત માહિતી આપો.

૨. પત્ર વ્યવહારના મૂળભૂત સિદ્ધાંતો જણાવી ધંધાદારી પત્રનું સ્વરૂપ અને ગોઠવણ વિષે વિસ્તૃત માહિતી આપો.

અથવા

અહેવાલની વ્યાખ્યા આપી તેની અગત્યતા, જરૂરિયાતો અને પ્રકાર વિષે ચર્ચા કરો.

વિભાગ ખ : મધ્યમ શ્રેષ્ઠીના પ્રશ્નોના જવાબ ૧૫૦૦ શબ્દોમાં આપો. (ગમે તે બે) (2x૧૫= ૩૦)

- ૧ કંપની સેકેટરી કોણ છે? તેનું સ્થાન અને લાયકાતો વિષે માહિતી આપો.
- ૨ કંપનીની સભાના પ્રકાર જણાવી તે માટેની જરૂરિયાત વિષે વિગતે ચર્ચા કરો.
- ૩ પત્રનું આયોજન જણાવી વાણિજ્યક પત્રના પ્રકારો વિષે માહિતી આપો.
- ૪ અહેવાલ લેખનની સામાન્ય માર્ગદર્શિકા જણાવી અહેવાલ લખવાની પ્રક્રિયા જણાવો.

ASP-01

વિભાગ :- (ગ) : નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (ગમે તે ચાર)

(૪×૫=૨૦)

- ૧ લાંબા અહેવાલ એટલે શું?
- ૨ બીબાળ પત્રો એટલે શું?
- ૩ પત્રની ગોઠવણી વિષે ટુંકમાં માહિતી આપો.
- ૪ સભાની કાર્યનોંધનો ખરડો તૈયાર કરવા બાબત માહિતી આપો.
- ૫ વાર્ષિક સામાન્ય સભા વિષે માહિતી આપો.

વિભાગ ઘ : ખાલી જગ્યા પુરો. (ગમે તે દશ)

(૧૫૧૦=૧૦)

- ૧ સેકેટરી કે જેને વિવિધતાસભર વહીવટી અને સંચાલકીય કાર્યો સૌંપવામાં આવેલ હોય તેને કહે છે.
- ૨ કે જેને રોજબરોજના ઓફિસકાર્યોનું સંકલન કરવાની જવાબદારી સૌંપવામાં આવે.
- ૩ સેકેટરી કે પ્રધાનની ઓફિસને કહે છે.
- ૪ કંપનીની નોંધણી પહેલા કંપનીના પ્રમોટરો કે પ્રવર્તકો દ્વારા નિમાયેલ સેકેટરીને સેકેટરી કહે છે.
- ૫ કંપની ધારામાં જણાવેલ ફરજોને અનુરૂપ હક્કોને હક્કો કહે છે.
- ૬ ભવિષ્યની તારીખે સભા ફરી ભરાવાના હેતુથી બંધ કરેલી સભાને સભા કહે છે.
- ૭ સભામાં હાથ ધરેલ કામકાજ, લેવાયેલ નિર્ણય, પસાર કરેલ દરાવ જેવી સભાની કાર્યવાહીના લેખિત રેકૉર્ડને કહે છે.
- ૮ હાજર રહેલ સભ્યોમાંથી બહુમતી સભ્યોએ પસાર કરેલ દરખાસ્તને કહેવાય.
- ૯ સભાની તારીખ, સમય અને સ્થળ અંગે અગાઉથી જાણ કરતુ લખાણ એટલે બને છે.
- ૧૦ સભાના વિચાર અર્થે મુકેલ વિધાનને કહે છે.
- ૧૧ જયારે દરખાસ્ત મંજુર કરવામાં આવે ત્યારે તે બને છે.
- ૧૨ આંકડા, ખ્યાલ કે પ્રસંગને સંકલિત કરી તૈયાર કરેલ પત્રકને કહેવાય.